



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૩/૨૦૧૯ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૫૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૪ કેસ કરી, ૭૯ વ્યક્તિઓને ઝડપી, ૨૪૭ લીટર દેશી દારૂ, ૩૩૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૩૫ બિયર ટીન અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૫ કેસ કરી ૦૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯,૭૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૫૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૦૩૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૫૬૦/૧૯

શહેરકોટડા: જ્યોત્સનાબેન વા/ઓ અનિલભાઈ સોનારા (ઉ.વ.૪૪)(રહે.બાઈ જીવીની ચાલી વોરાના રોઝા પાસે નુતન મીલ ચાર રસ્તા સરસપુર)એ તા.૨૭/૦૩/૨૦૧૯ નારોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૧૨/૧૮ થી તા.૩૦/૧૨/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન બાઈજીવીની ચાલીમાં રહેતા જ્યોત્સનાબહેન તથા અન્ય સાહેબના ઘરે મુસ્કાન ઉર્ફે નોમીન છીપા ઉર્ફે હલીમા તથા તેમના પતિ (બંને રહે. છીપાવાડ જમાલપુર) નાઓએ ભેગામળી સસ્તા ભાવે કરિયાણાની ચીજ વસ્તુઓ આપવાની લોભામણી વાતો કરી, વિશ્વાસમાં લઈ, પોતાના તેમજ ચાલીના અન્ય રહીશો ની કુલ રૂપિયા ૧,૮૬,૯૮૦/- મતાની કરિયાણાની ચીજ-વસ્તુઓના ઓર્ડર લઈ, આજદિન સુધી ઓર્ડર મુજબની કોઈપણ ચીજ-વસ્તુઓ નહી આપી, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આઇ.ચૌધરી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૫૬૧/૧૯

કૃષ્ણનગર : પિયુષ કાંતીલાલ ભુપતાણી (રહે. વિક્રમાદિત્ય સોસાયટી, વિક્રમપાર્ક સામે કૃષ્ણનગર) એ તા.૨૭/૦૩/૨૦૧૯ ના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૩/૨૦૧૯ રાતના ૦૮/૦૦ થી તા.૨૭/૦૩/૧૯ ના કલાક ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી રોકડ રૂપિયા ૧૭,૧૩,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી.આર.ચૌધરી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૫૬૨/૧૯

સરદારનગર : દીપીકાબેન વા/ઓ નરેન્દ્રભાઈ બેલાણી (ઉ.વ.૩૪)(રહે.તોલારામ ગલી કુબેરનગર સરદારનગર) એ તા.૨૭/૦૩/૨૦૧૯ ના રોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૩/૨૦૧૯ સાંજના ૭/૩૦ થી પાંચ દિવસ પહેલા ના સમયગાળામાં પોતાના મકાનના ખુલ્લા દરવાજે થી અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, કબાટમાં મુકેલ પર્સમાંથી સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા ૩,૪૦,૦૦૦/- મતાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.સી.શેખ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૫૬૩/૧૯

વેજલપુર : અસરફહુશેન અહેમદફહુશેન મન્શુરી (ઉ.વ.૪૬)(રહે.કાયા છાપરામાં બરફની કેક્ટરી સામે વિશાલા રોડ શાહવાડી) એ તા.૨૭/૦૩/૨૦૧૯ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૦૩/૨૦૧૯ રાતના ૧/૦૦ થી. સવારના ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરની સામે કચરાપેટી પાસે પોતાની સુઝુકી ઇકો ગાડી નંબર GJ/01/MP/2019/34429 કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- મતાની પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.વણઝારા ચલાવે છે.

મશીનમાં હાથ આવી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૬૪/૧૯

દાણીલીમડા : અતુલભાઈ રાજકુમાર દીવાકર (ઉ.વ.૨૦)(રહે.બુધ્ધનગર નારોલ) તા.૨૪/૦૩/૧૯ ના કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે દાણીલીમડા ખાતે આવેલ સીધેશ્વરી ડેનીમ ફેક્ટરી કંપનીમાં વોશીંગના મશીનમાં કાપડ ખેચવા જતા, કાપડમાં હાથ ફસાઈ જતા નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ થતા, સારવાર અર્થે તેમને સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૭/૦૩/૨૦૧૯ ના કલાક ૧૦/૫૦ વાગે અતુલભાઈનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી સોહાબખાન અઝીઝખાન ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૫૬૫/૧૯

રીવરફ્રન્ટ ઇસ્ટ : જગદીશભાઈ ઉર્ફે જીતુ મફાજી (ઉ.વ.૩૦)(રહે.ખોડીયાર માં ની ચાલી રામાપીર નો ટેકરો નવા વાડજ) એ કોઈ અગમ્ય કારણસર તા.૨૬/૦૩/૨૦૧૯ ના કલાક ૧૦/૩૦ વાગ્યાના સુમારે રીવરફ્રન્ટ દધીચી બ્રીજ નજીક સાબરમતી નદીમાં પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નિશારઅહેમદ ઉસ્માનમીયા ચલાવે છે.

બાપુનગર : ભાનુબેન વા/ઓ પરષોતમભાઈ સોલંકી (ઉ.વ.૩૦)(રહે.સંજયનગરના છાપરા કમલ બેકરીની લાઇનમાં બાપુનગર) એ પોતાની બીમારી થી કંટાળી જઈ તા.૨૬/૦૩/૧૯ બપોર ના ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લેતા, સારવાર માટે તેમને સિવીલ હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૭/૦૩/૨૦૧૯ ના કલાક ૦૬/૦૦ વાગે ફરજ ઉપરના ડો.શ્રી.એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.રાઠોડ ચલાવે છે.

નિકોલ : યજ્ઞેશકુમાર દિનેશભાઈ સોડાઘર (ઉ.વ.૨૧)(રહે.ખોડિયાર નગર વિભાગ-૨, નારાયણનગરની બાજુ માં નિકોલ) એ કોઈ અગમ્ય કારણસર તા.૨૭/૦૩/૨૦૧૯ ના કલાક ૦૭/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોડાની છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ચીમનસિંહ ગુલાબસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.